

આવકવેરાની જોગવાઈ	૫૫૦૦		
ચોખ્ખો નફો	૧૧૨૫૦૦		
	૧૬૨૫૦૦		૧૬૨૫૦૦

પડતરના હિસાબો તપાસતા નીચેની માહિતી પ્રાપ્ત થઈ છે.

(૧) માલસામાન અને મજૂરી ખર્ચ તેની પડતર કિંમતે જ દર્શાવવામાં આવે છે (૨) કારખાનાના ખર્ચો, મજૂરીના ૫૦% લેખે ફાળવવામાં આવે છે (૩) ઓફિસ ખર્ચો, કારખાના પડતરના ૧૦% લેખે વસૂલ કરવામાં આવે છે (૪) વેચાણ ખર્ચો, વેચેલ એકમ દીઠ રૂ.૨.૫૦ લેખે ગણેલ છે. ઉપરની માહિતી પરથી (અ) પડતરના હિસાબો મુજબ નફો કે નુકસાન દર્શાવતું પત્રક (બ) પડતરના હિસાબો તથા નાણાકીય હિસાબો મુજબ દર્શાવેલ નફા-નુકસાનની મેળવણી દર્શાવતું પત્રક.

પ્રશ્ન-૨ ટ્રેકનોંધ લખો (ગમે તે એક)

(૧) વર્તણૂક કે ગુણ પ્રમાણે વર્ગીકરણ (૨) પડતર હિસાબી પદ્ધતિના હેતુઓ (૨) પડતર હિસાબી પદ્ધતિના ફાયદા

અથવા

પ્રશ્ન-૨ એક કંપનીના ત્રણ ઉત્પાદન વિભાગો છે અને બે સેવા વિભાગો છે. કંપનીના ચોપડેથી નીચે જણાવેલ આંકડાઓ લેવામાં આવ્યા છે

ભાડુ અને વેરા	૧૦૦૦૦	પાવર	૩૦૦૦
પરોક્ષ મજૂરી	૩૦૦૦	સામાન્ય દીવાબત્તી	૧૨૦૦
ચંત્રો પર ધસારો	૨૦૦૦૦	પરચૂરણ ખર્ચ	૨૦૦૦૦

વધારાની માહિતી નીચે મુજબ છે

વિગત	ઉત્પાદન વિભાગો			સેવા વિભાગો	
	અ	બ	ક	ડ	છ
રોકેલી જગ્યા (ચો.મી.)	૨૦૦૦	૨૫૦૦	૩૦૦૦	૨૦૦૦	૫૦૦
લાઇટ પોઇન્ટ	૧૦	૧૫	૨૦	૧૦	૫
પ્રત્યક્ષ મજૂરી રૂ.	૩૦૦૦	૨૦૦૦	૩૦૦૦	૧૫૦૦	૫૦૦
ચંત્રોના હોર્સ પાવર	૬૦	૩૦	૫૦	૧૦	-
ચંત્રોની કિંમત રૂ.	૬૦૦૦૦	૮૦૦૦૦	૧૦૦૦૦	૫૦૦૦	૫૦૦૦
કામકાજના કલાકો	૬૨૨૬	૪૦૨૮	૪૦૬૬	-	-

સેવા વિભાગોના ખર્ચો નીચે મુજબ ફાળવવામાં આવે છે.

	અ	બ	ક	ડ	છ
ડ	૨૦%	૩૦%	૪૦%	--	૧૦%
છ	૪૦%	૨૦%	૩૦%	૧૦%	--